

બ્રમ્પટનમાં યોજાશે કાઉન્ટડાઉન ટૂ કોલિઝન (Countdown to Collision)!

બ્રમ્પટન, ઓન્ટારિયો (13 મે 2022) – સિટી ઓફ બ્રમ્પટનની આર્થિક વિકાસ કચેરી (EDO) 18 મે, બુધવારે સાંજે 6 થી 10 વાગ્યા સુધી [કાઉન્ટડાઉન ટૂ કોલિઝન \(Countdown to Collision\)](#) નું આયોજન દરોજમાં કરવા ઉત્સાહિત છે.

ટોરોન્ટોમાં થનાર કોલિઝન કોન્ફરન્સ પહેલા બ્રમ્પટનને કેનેડાના છ શહેરો પૈકી એક તરીકે પસંદ કરવામાં આવ્યું જ્યાં એક રૂબરૂમાં થનાર પ્રસંગ યોજાશે જેથી જુન 20 થી જુન 23 સુધી ટોરોન્ટોમાં આયોજીત કોન્ફરન્સ માટે લોકોમાં ઉત્સાહ ઊભો થાય અને ટેક ઇકોસિસ્ટમોનું મિલન કરી શકાય.

આ નિઃશુલ્ક કાઉન્ટડાઉન ટૂ કોલિઝન (Countdown to Collision) ઇવેન્ટમાં ઇસાક ઓલોવોલાફ જુનિયર સાથે ફાયરસાઈડ ચેટ કરીશું અને મુખ્ય સંબોધન કરશે વસ હોલ જેના બાદ રિસેપ્શન સમારોહ હાથ ધરાશે જેમાં બ્રમ્પટનના સ્ટાર્ટ અપ સમુદાયને એક બીજા સાથે નેટવર્કિંગ કરવાનો અવસર સાંપડશે.

[ઇસાક ઓલોવોલાફ જુનિયર](#) is the Founder and General Partner of ડ્રીમ મેકર વેન્યર્સ (DMV)ના સ્થાપક અને જનરલ પાર્ટનર છે, જે ટોરોન્ટોની એક અર્લી સ્ટેજ વેન્યર પેઢી છે. તેઓ એવોર્ડ વિજેતા રીઅલ એસ્ટેટ સાહસિક, એન્જલ રોકાણકાર અને દાનેશ્વરી પણ છે. વેસ હોલ અશ્વેત વિરોધી જાતિવાદ સામે કાર્ય કરતી કેનેડિયન કાઉન્સિલ ઓફ બિઝનેસ લિડર્સ અને બ્લેકનોર્થ ઇનિશિએટિવના સ્થાપક અને અધ્યક્ષ છે. હોલ ડ્રેગન ડેનના સૌથી નવા સભ્ય છે જ્યાં તેઓ પોતાની મર્જર અને એક્વિઝિશન અંગેની વર્ષોની કુશળતા ડેન ખાતે લાવશે અને કેનેડાના ભાવિ સાહસિકો સમક્ષ લાવશે.

[કોલિઝન](#) ઉત્તર અમેરિકામાં સૌથી ઝડપી વિકાસ પામતી ટેક કોન્ફરન્સ છે જ્યાં તે "વિશ્વના ટોચના વક્તાઓ", ટેકની અગ્રેસર કંપનીઓ અને ટોચના મિડિયાને એક જ સ્થળે ભેગા કરશે. આવા વૈશ્વિક ઇવેન્ટમાં સિટી ઓફ બ્રમ્પટન આ વખતે ત્રીજી વખત સહભાગ લેશે. 2021માં ઇકોનોમિક ડેવેલપમેન્ટ ઓફિસે સિટી ઓફ બ્રમ્પટનના 38,000 સહભાગીઓને ઓનલાઈન પ્રદર્શિત કરવા અને 141 દેશોમાં 1200 સ્ટાર્ટ અપ્સને સામે લાવવા વર્ચુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો જેમાં બ્રાઝિલથી ભારત સુધીના ઘણા દેશો હતાં જેમાં બ્રમ્પટન ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ પર ભાર મુકવામાં આવ્યો અને વૈશ્વિક પ્રેક્ષકો સામે બીહાઈવ (Bhive)ને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. 2019માં સિટીના પ્રતિનિધિઓએ પોર્ચ્યુગલના લિસ્બનનો પ્રવાસ કર્યો હતો જેથી વેબ સમીટમાં ભાગ લઈ શકાય અને જેથી 70000 સહભાગીઓને જાણ થાય કે "બ્રમ્પટન ઇઝ નાવ" એટલેકે બ્રમ્પટન જ વર્તમાન છે જેમાં સિટીના અનન્ય રોકાણ લાયક અવસરો પર વૈશ્વિક સ્તરે પ્રદર્શિત થયા.

બ્રમ્પટનમાં કાઉન્ટડાઉન ટૂ કોલિઝન (Countdown to Collision) ચુકશો નહીં! ૬ રોઝ, બ્રમ્પટન ખાતેના નિ:શુલ્ક ઇવેન્ટ માટે [અહીં રજીસ્ટર થાવ](#). કોલિઝન 2022 ખાતે સિટી ઓફ બ્રમ્પટન વિશે વધુ જાણકારી લેવા અહીં મુલાકાત લો investbrampton.ca/collision-2022.

બ્રમ્પટન ઇનોવેશન મોબાઇલ

EDO હવે જાહેરમાં આવી ચુક્યા છે! કાઉન્ટડાઉન ટૂ કોલિઝન દરમિયાન આખી ટીમ નવી અને આવરણ હેઠળની બ્રમ્પટન ટ્રાન્ઝિટ બસનું અનાવરણ કરવા ઉત્સુક છે જે ઇનોવેશન ડિસ્ટ્રિક્ટને અને સંસાધનોની આખી શ્રેણી માટે સહાયરૂપ તો થશે જ પરંતુ સાથે સાથે સ્થાનિક આઉટરીચ પહેલોને સહાયતા પ્રદાન કરવામાં પણ મદદરૂપ થશે.

સુવાક્યો

"કાઉન્ટડાઉન ટૂ કોલિઝનનો પ્રારંભ થઈ ચુક્યો છે! ગત વર્ષે કોલિઝનમાં સફળ કામગીરીનું પ્રદર્શન કર્યા બાદ અમે આ વર્ષે પાછા ફરવા હવે તૈયાર છીએ જેથી વિશ્વને બતાવી શકીએ કે બ્રમ્પટન શું ચીજ છે. અમે કેનેડાનું અગ્રેસર ટેક ક્લબ બનવાના આરે છીએ અને કોલિઝન ખાતે હજું બીજા વર્ષનો પ્રારંભ કરીશું ત્યારે સન્માનની લાગણી થાય છે કે કેનેડામાંથી પસંદ થયેલા છ જ શહેરો પૈકી અમે એક છીએ જેઓ કોલિઝનમાં હજું એક વર્ષ શરૂ કરશે."

- *પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન*

"બ્રમ્પટન અવસરોનું શહેર છે જ્યાં – આપણા ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ અને બીહાઇવ (Bhive) જેવા સંસાધનો સાથે – આપણા સાહસિકો અને સ્ટાર્ટ અપ્સ ખરેખર વિકસી શકે. હું સર્વે જનને કાઉન્ટડાઉન ટૂ કોલિઝન માટે રજીસ્ટર કરાવવા પ્રોત્સાહિત કરું છું જેથી ભવિષ્યમાં શું થશે તે વિશે પ્રેરિત થઈ શકાય અને પછીથી જુનમાં કોલિઝન કોન્ફરન્સ માટે તૈયારી કરી શકાય."

- *માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4; પ્રમુખ, ઇકોનોમિક ડિવલપમેન્ટ, સીટી ઓફ બ્રમ્પટન*

"કાઉન્ટડાઉન ટૂ કોલિઝન આખા કેનેડામાં આ વર્ષના મુખ્ય ઇવેન્ટની અપેક્ષાસહ પ્રસરી રહ્યું છે અને તેઓ અહીં આપણા બ્રમ્પટનમાં રોકાણ કરશે કેમકે ઇનોવેશન, પરિકલ્પનાઓ અને અવસર માટેનું સ્થળ આ જ તો છે. આજે જ પોતાની નિ:શુલ્ક ટિકિટો મેળવી લો અને વેસ હોલ, ઈસાક ઓલોવોલાફ જુનિયરના અને બ્રમ્પટનના પોતાના સ્ટાર્ટ અપ સૂપરસ્ટારોના કાર્યોથી પ્રેરણા મેળવો.

- *પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપ પ્રમુખ, ઇકોનોમિક ડિવલપમેન્ટ, સીટી ઓફ બ્રમ્પટન*

"સિટી ઓફ બ્રેમ્પટનને વેસ હોલ અને ઈસાક ઓલોવોલાફ જુનિયરના તેમજ કાઉન્ટાઉન ટૂ કોલિઝન ઈવેન્ટના યજમાન બનતા સન્માનની લાગણી થાય છે. આપણી ઈકોનોમિક ડેવેલપમેન્ટ ઓફિસ દિનિયાને બતાવવા સજ્જ છે કે બ્રેમ્પટન સાહસિકોના વિશ્વમાં એક મુખ્ય ખેલાડી છે અને 2021ના કોલિઝનની સફળતા બાદ મને આ વર્ષના ઈવેન્ટમાં શું શું થશે તે જાણવાની અત્યંત ઉત્સુકતા છે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર , સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca